

—:: ટેન્ડર નોટીસ ::—



આથી રસ ધરાવતા તમામ ઈસમોને જણાવવાનું કે, આચાર્યશ્રી, કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઈ(ડાંગ) ખાતેની બિન વપરાશી એમ્બેસેડર જીપનં.જીજે-૨૧-૬૬૭૨ (મોડલ ૨૦૦૫-૦૬)નો ટેન્ડર પધ્ધતિથી નિકાલ કરવાનો હોય, રસ ધરાવતા ઈસમોએ વિગતવાર જાહેરાત અને કોરી ટેન્ડર કોપી www.nau.in વેબ સાઈટ ઉપરથી ડાઉનલોડ કરી, આ ટેન્ડરની બોલીઓ અને શરતો મુજબની માહિતી ભરી તેના ટેન્ડર ફી, બાનાની રકમનો ચેક આચાર્યશ્રી, કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઈ(ડાંગ)ના નામનો બનાવી પોતાનો ભાવ ટેન્ડર ફોર્મમાં ભરી સીલબંધ કવરમાં તા.૧૧/૧૦/૨૦૨૧ સાંજના ૧૭:૦૦ કલાક સુધીમાં અત્રેની કચેરીને રૂબરૂ / કુરીયર/ પોસ્ટ/ સ્પીડ પોસ્ટ/ રજી.પોસ્ટ.એ.ડી. થી ભાવો મોકલી આપવાના રહેશે. છેલ્લી તારીખ પછી આવેલ કોઈપણ ટેન્ડરને ખોલવામાં આવશે નહીં, ટેન્ડર ફી અને બાનાની રકમ વગરની ઓફરો માન્ય રાખવામાં આવશે નહીં જેની નોંધ લેશો.

સ્થળ:-વઘઈ
તા.૨૩/૦૯/૨૦૨૧

સહી/- આચાર્ય

કામનું નામ:- આચાર્ય, કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઈ (ડાંગ)ના વાહનનો ટેન્ડર પદ્ધતિથી નિકાલ કરવા બાબત...

વાહન હરાજની શરતો

૧.	વાહન અત્યારે જે હાલતમાં અને જે સ્થળે જે પરિસ્થિતિમાં છે. તે રીતે ટેક્ષ તથા વિમાની કોઈપણ જવાબદારી સિવાય વેચાણ કરવાનું છે.
૨.	એમ્બેસડર જીએ-૨ ૧-૬૬૭૨ જાહેરાતમાં દર્શાવેલ સ્થળે જાહેર રજના દિવસો સિવાય સવારે ૧૦.૩૦ થી ૧૭.૦૦ કલાક સુધીમાં જોવા મળશે. જેથી જે વ્યક્તિ / ઇસમને આ વાહનનો ખરીદવામાં રસ હોય તેમણે ભાવ ભરતા પહેલા આ વાહનનું નિરીક્ષણ અને જે તે વાહનની જરૂરી માહિતી મેળવી લેવા જણાવવામાં આવે છે.
૩.	ટેન્ડર ફોર્મ તથા ટેન્ડરની શરતો અને બોલીઓ યુનિવર્સિટીની વેબ સાઈટ www.nau.in પરથી ડાઉનલોડ કરી તા.૧૧.૧૦.૨૦૨૧ સુધીમાં આચાર્ય કૃષિ મહાવિદ્યાલય, ન.ક.યુ , વઘઈ(ડાંગ) ની કચેરીને ટપાલ/કુરિયરથી પહોચતા કરવાના રહેશે. કવરમાં ટેન્ડર ફોર્મ, શરતો અને બોલીઓની સહીવાળી કોપી તથા ટેન્ડર ફી અને બાનાની રકમનો ચેક મોકલવાનો રહેશે. ટેન્ડર ફી રૂ. ૫૦૦/- તથા બાનાની રકમનો ચેક રૂ. ૫૦૦૦/- " Principal College of Agriculture, NAU, Waghai (Dang)"ના નામનો કાઢવાનો રહેશે. ટેન્ડર ફી અને બાનાની રકમનો ચેક રાષ્ટ્રીયકૃત બેંક/સીડયુલ બેંકનો હોવો જોઈએ.
૪.	ટેન્ડર ફોર્મ સાથે આવેલ ટેન્ડર ફી નોન રિફંડીબલ છે જેથી તે પરત મળવા પાત્ર નથી, તથા બાનાની રકમનો ડી ડી પાછળથી ટેન્ડરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીના નિયમો અનુસાર પરત કરવામાં આવશે. બાનાની રકમ અને ટેન્ડર ફી વગરની ઓફર ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
૫.	વાહન ખરીદ કરવાના ભાવો યુનિવર્સિટીની વેબ સાઈટ પર પ્રસિધ્ધ થયેલ જાહેરાત મારફત જ ટેન્ડર ફોર્મમાં જ ભરવાના રહેશે.
૬.	ટેન્ડર ખોલવાની તારીખ અને સમયની જાણ ટેલીફોન દ્વારા કરવામાં આવશે. ઈજારદારો અથવા તેના પ્રતિનિધિએ કૃષિ મહાવિદ્યાલય, વઘઈ ખાતે હાજર રહેવું. જેમનું ટેન્ડર મંજૂર થશે તેમણે ઈજારની રકમ નીચેની વિગતે ભરવાની રહેશે.
૭.	ટેન્ડર ફોર્મમાં ભરેલ ભાવના ૫૦% રકમ ટેન્ડર મંજૂર થયેથી તુરંતજ ભરપાઈ કરવાના રહેશે. બાકીની ૫૦% રકમ દિન ૦૫માં જમા કરાવવાની રહેશે. આર.ટી.ઓ. પેપર્સ તૈયાર કરીને વાહનને અત્રેથી લઈ જવાનું રહેશે અને તેમાં નિષ્ફળ જનારને તેમની ઈએમડી કોઈપણ કારણ જણાવ્યા સિવાય જપ્ત કરવામાં આવશે. તેમજ ભવિષ્યમાં તેમને યુનિવર્સિટીની કોઈ પણ હરાજ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવશે.
૮.	ટેન્ડરના કવર ઉપર " વાહન હરાજનું ટેન્ડર ફોર્મ " અવશ્ય લખવાનું રહેશે. પાર્ટીનું નામ, સરનામું અને મોબાઈલ નંબર મોટા અક્ષરે લખવું.
૯.	(અ). ટેન્ડર દ્વારા આવેલ ભાવો કમિટીને અપસેટ વેલ્યુ કરતાં નીચા જણાય તો તે સ્થળે કમિટીના અભિપ્રાય મુજબ ટેન્ડર ભરનાર પાર્ટીઓ વચ્ચે જાહેર હરાજથી નિકાલ કરવામાં આવશે. જાહેર હરાજમાં પણ ભાવો કમિટીને અપસેટ વેલ્યુ કરતાં ઓછા જણાય તો હરાજ રદ કરવામાં આવશે. (બ). ટેન્ડર ભરનાર ઈસમોને કોઈપણ સંજોગોમાં ટેન્ડર ફી ની રકમ પરત કરવામાં આવશે નહીં જેની નોંધ લેવી.
૧૦.	લાગેલ ટેન્ડરની રકમ ઉપરની મુદતમાં જમા કરવામાં નહીં આવશે તો ઈજારો રદ કરવામાં આવશે. અને બાનાની રકમ જપ્ત કરવામાં આવશે, કોઈ પણ સંજોગોમાં ઈજારની રકમ ભરવાની મુદત વધારી આપવામાં આવશે નહીં જેની નોંધ લેશે.
૧૧.	વાહન વેચાણ થયા બાદ તેના આર.ટી.ઓ. પેપર્સ (વીમો, રજીસ્ટ્રેશન, ટેક્સ વગેરે) તેમજ વાહન ટ્રાન્સફર કરવાની સઘળી જવાબદારી જે તે ટેન્ડર ભરનારની રહેશે. અત્રેથી જરૂરી દસ્તાવેજ પેપરમાં સંબંધિત વિભાગ તરફથી સહી કરી આપવામાં આવશે. આર.ટી.ઓ. પેપર્સની કાર્યવાહી સંપૂર્ણપણે પૂરી થયા બાદ બાનાની રકમ પરત કરવામાં આવશે. તેમજ વાહનનો કબજો મેળવ્યાથી તમામ જવાબદારી ખરીદ કરનારની રહેશે.
૧૨.	વાહન જે તે ઈજારદારે જ તેમના માણસો સાથે હાજર રહી લઈ જવાનું રહેશે. તેમની ગેરહાજરીમાં કોઈ પણ ઈસમને લઈ જવા દેવામાં આવશે નહીં. તેમજ હરાજ સમયે જેણે ઈજારો રાખ્યો હશે તે બીજા ઈસમને ઈજારો આપી શકશે નહીં.
૧૩.	હરાજ બાબતે કોઈ પણ જાતની તકરાર મુશ્કેલી કે મુદ્દો ઊભો થાય તો નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઈ (ડાંગ) નો નિર્ણય આખરી ગણાશે. જે ખરીદનારને બંધન કરતો રહેશે અને કાયદાકીય જ્યુરિડિકેશન નવસારી રહેશે.
૧૪.	સંજોગોવશાત ઉપરોક્ત શરતોમાં કોઈ પણ ફેરફાર યુનિવર્સિટીના સત્તાધીશો તરફથી કરવામાં આવે તો તે માન્ય રાખવા પડશે અને તે અંગે કોઈ તકરાર સ્વીકારવામાં આવશે નહિ. તેમજ યુનિવર્સિટી દ્વારા રચેલ કમિટીનો નિર્ણય આખરી ગણાશે. જે ખરીદ કરનારને બંધનકર્તા રહેશે.
૧૫.	કોઈપણ ટેન્ડરને સ્વીકારવું અથવા આવેલ તમામ ટેન્ડરને કોઈપણ કારણો દર્શાવ્યા સિવાય રદ કરવાના તથા ઈજારો મંજૂર રાખવો કે નહીં તેની સત્તા યુનિવર્સિટી દ્વારા રચેલ કમિટીની રહેશે.
૧૬.	જે તે વાહનનું રજીસ્ટ્રેશન રિન્યુ કરાવવાની જવાબદારી મંજૂર થયેલ ઈજારદાર કે પાર્ટીની રહેશે.
૧૭.	સદર વાહનની આર.ટી.ઓ ટેક્ષ, વીમો, સરકારી ટેક્ષ તથા અન્ય તમામ પ્રકારના ભરણાની જવાબદારી વાહન લેનારની રહેશે
૧૮.	ભાવ ભરનાર વ્યક્તિ / ઈસમ ભારતનો નાગરિક હોવો જોઈએ, તેમજ તે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ ન હોવો જોઈએ.
૧૯.	ભાવ ભરનાર વ્યક્તિ / ઈસમ આધાર કાર્ડ તથા પાન કાર્ડ ધરાવતો હોવો જોઈએ. (સ્વપ્રમાણિત નકલ બિડવી)આધાર કાર્ડ તથા પાન કાર્ડ વગરની ઓફર ગ્રાહ્ય રાખવામાં નહિ આવે. જેની ખાસ નોંધ લેવી.
૨૦.	આ હરાજમાં વાહનની વિગત અને ફોટાઓની માહિતી આપી છે. આ હરાજમાં ભાગ લેનાર કોઈ પણ વ્યક્તિ / ઈસમે વાહનની હરાજના ભાવો ભરવાના હોય તેમણે ફોર્મ ડાઉનલોડ કરી તેમની સાથે તેમની ભરવાની થતી ટેન્ડર ફી તથા અલગ બાનાની રકમ બિનચૂક ભરવાની રહેશે

ઉપરની તમામ શરતો મને માન્ય / કબુલ / બંધન કરતાં છે.

તારીખ:-

ટેન્ડર ભરનારનું નામ:-

સ્થળ:-

સરનામું:-

ટેન્ડર ભરનારની સહી :-

મોબાઈલ નંબર:-

આચાર્ય,
કૃષિ મહાવિદ્યાલ,
નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઈ (ડાંગ)

--: વાહન વેચવા માટેનું ભાવપત્રક :-

ટેન્ડર ફી :-

રસીદ નંબર :-

૧.	વાહનની વિગત	::	એમ્બેસડર જીએ-૨૧-૬૬૭૨ મોડેલ વર્ષ :- ૨૦૦૫-૦૬ ચાલેલ કિમી:-૧૮૮૮૬૪.૦૦
	હાલમાં વાહન રૂબરૂ જોવા માટેનું સ્થળ	::	કોલેજ ઓફ એગ્રિકલ્ચર, ન.કૃ.યુ.,વઘઈ,જી. ડાંગ મો.નં. ૯૮૭૯૦૩૮૫૩૯
૨.	ટેન્ડર ફીની વિગત	::	ચેક નં. બેંકનું નામ:- તારીખ :-
	અનામત ભર્યાની વિગત	::	ચેક નં. બેંકનું નામ:- તારીખ :-
૩.	ખરીદી કરવા માટેની કરેલી ઓફર રૂપિયા (આકડામાં)	::	
	ખરીદી કરવા માટેની કરેલી ઓફર રૂપિયા (શબ્દમાં)	::	
૪.	લેનાર પાર્ટીનું નામ તથા પૂરેપુરું સરનામું	::	
૫.	આધાર કાર્ડ નંબર (સ્વપ્રમાણિત નકલ બિડવી)	::	
૬.	પાન કાર્ડ નંબર (સ્વપ્રમાણિત નકલ બિડવી)	::	

આપની જાહેરાતની શરતો અને બોલીઓ હું/અમોએ વાંચી છે/સમજી છે અને જે મુજબ આ વાહન હું/અમોએ ઉપરોક્ત સ્થળે રૂબરૂમાં જોઈ તપાસી તે મુજબ હું/અમોએ આ વાહનની રૂ/.(આકડામાં) અંકે રૂપિયા (શબ્દમાં) ટેન્ડરની શરતો અને બોલીઓ મુજબ ખરીદ કરવા મારી ઓફર/બોલી આપું છું. આ સાથે આ ટેન્ડરની શરતો અને બોલીઓ મુજબ હું/અમો ઉપરોક્ત વિગતો મુજબ ટેન્ડર ફી અને બાનાની રકમ ચેક સ્વરૂપમાં જમા કરવું છું.

તારીખ :-

સ્થળ:-

વાહન ખરીદ માટે ઓફર કરનારની સહી

તથા પૂરેપુરું નામ અને સરનામું



28.Apr.2020



28.Apr.2020



